

અનુવાદક

અનુવાદકો એક એવા વ્યાવસાયિકો છે જેઓ લખાણને એક ભાષામાંથી બીજી ભાષામાં ચોક્કસાઈપૂર્વક રૂપાંતરિત કરી શકે છે. કાયદાકીય, વૈજ્ઞાનિક અને વ્યાવસાયિક ગ્રંથોને વિવિધ દેશો અને ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા માટે તેમનું કાર્ય મહત્વપૂર્ણ છે. એક સારો અનુવાદક મૂળ દસ્તાવેજની સંકલ્પના અને અર્થ શક્ય તેટલું જાળવી રાખશે.

વ્યક્તિગત નિપુણતા ★★

- તમને નવી ભાષાઓ શીખવી/બોલવી ગમે છે
- તમે અન્ય લોકો સાથે સહજ રીતે વાતચીત કરી શકો છો
- તમે સારા શ્રોતા છો
- તમે વિગતો પર ધ્યાન આપો.



આ અભ્યાસક્રમની ફી આશરે રૂ. ૩૦,૦૦૦ થી ૩,૦૦,૦૦૦* જેટલી હોય છે.

*આ અંદાજિત રકમ છે અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ મુજબ તેમાં ફેરફાર હોય શકે છે.

શિષ્યવૃત્તિ

- રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ - www.scholarships.gov.in ની મુલાકાત લો. આ પોર્ટલ હેઠળ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો, UGC/AICTE યોજનાઓ તેમજ રાજ્ય દ્વારા અમલમાં મુકવામાં આવેલી યોજનાઓ દ્વારા આપવામાં આવતી સહાય અંગેની માહિતી ઉપલબ્ધ છે.*
 - ઉપલબ્ધ શિષ્યવૃત્તિની વિગતો માટે digitalgujarat.gov.in ની મુલાકાત લો. ધોરણ XI થી શરૂ થતી શિષ્યવૃત્તિ માટે આ એક પ્રવેશદ્વાર છે.*
 - યોગ્યતાના આધારે સંસ્થાઓમાં પણ શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે.*
- *(આ શિષ્યવૃત્તિની ઉપલબ્ધતા સમયાંતરે બદલાઈ શકે છે)

લોન

- વિદ્યાલક્ષ્મી, www.vidyalakshmi.co.in, શૈક્ષણિક લોન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટેનું એક પોર્ટલ છે. આ પોર્ટલ નાણાકીય સેવા વિભાગ, (નાણાં મંત્રાલય), ઉચ્ચ શિક્ષણ વિભાગ (શિક્ષણ મંત્રાલય) અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA)ના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવેલ છે.
- કેટલાક રાજ્યોમાં ઓછા વ્યાજ દરો સાથે વિદ્યાર્થી કેડિટ કાર્ડ ઉપલબ્ધ છે, ઉદાહરણ તરીકે, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, વગેરે.
- તમામ બેંકો શૈક્ષણિક લોન આપે છે.



પ્રવેશ માટે...

૧. કોઈપણ વિદ્યાશાખામાં ધો. ૧૨ પૂર્ણ કરો.
૨. તમારી પસંદગીની ભાષામાં સ્નાતક (BA)ની ડિગ્રી મેળવો. ત્યારબાદ, તે જ વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરો.

અથવા

તમારી પસંદગીની ભાષામાં સ્નાતક (BA)ની ડિગ્રી મેળવો. ત્યારબાદ, તમારી પસંદગી વિદેશી ભાષામાં ડિપ્લોમા કરો. કૃપા કરીને નોંધણી દરમિયાન અભ્યાસક્રમનો સમયગાળો તપાસો



અપેક્ષિત આવક

*અહીં આપેલ આંકડાઓ ફક્ત સૂચક છે અને ફેરફારને પાત્ર છે.

અનુવાદકનું અંદાજિત માસિક વેતન
રૂ. ૧૨,૬૬૭ થી ૮૦,૦૦૦* જેટલું હોય છે.

સ્ત્રોત: <https://www.payscale.com/research/IN/Job=Translator/Salary>

તમે ક્યાં કામ કરશો?

કાર્યસ્થળ : શાળાઓ, હોસ્પિટલો, કોર્ટરૂમ, મીટીંગ રૂમ, પરિસંવાદ કેન્દ્રો.

ઉદ્યોગ સાહસિકતા : તમે ખાનગી અનુવાદ કંપની/ફર્મ શરૂ કરી શકો છો તેમજ ફીલાન્સિંગ સેવાઓ પણ આપી શકો છો.

કાર્યસ્થળનું વાતાવરણ: કામનો સમય સામાન્ય રીતે અઠવાડિયામાં ૫ થી ૬ દિવસ, પ્રતિ દિવસ ૮ થી ૯ કલાકનો હોય છે. શિફ્ટ પ્રથા ઉપલબ્ધ હોય છે.

આ ક્ષેત્રમાં દિવ્યાંગ લોકો માટે કામ કરવાની તકો ઉપલબ્ધ છે.

અપેક્ષિત પ્રગતિ પથ



સહયોગી અનુવાદક → અનુવાદક → વરિષ્ઠ અનુવાદક → વિભાગના વડા (અનુવાદ)

સર્ચ માટેના કીવર્ડ્સ ...



ઈન્ટરપ્રિટર, લેંગ્વેજ સ્પેશ્યાલિસ્ટ, લેંગ્વેજ એક્સપર્ટ

તમે અભ્યાસ ક્યાં કરશો?

આ અભ્યાસક્રમ આર્ટ્સ વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સંસ્થાઓની અહીં આપેલ યાદી માત્ર સૂચક છે.

સરકારી સંસ્થાઓ

૧. એમ.એસ.યુ., વડોદરા
૨. અવ્યયાર ગવર્નમેન્ટ કોલેજ ફોર વુમન, કરાઈકલ
૩. આશુતોષ કોલેજ, કોલકાતા
૪. ડિબ્રુગઢ હનુમાનબક્ષ સૂરજમલ કનોઈ કોલેજ, ડિબ્રુગઢ
૫. ડેરા નટુંગ ગવર્નમેન્ટ કોલેજ, ઈટાનગર
૬. કે.એસ.કે.વી.કે.યુ., કચ્છ
૭. ઈવિંગ ક્રિશ્ચિયન કોલેજ, અલ્હાબાદ
૮. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

ખાનગી સંસ્થાઓ

(અરજી કરતા પહેલા તપાસ કરો કે શું સંસ્થા યુ.જી.સી. સાથે સંલગ્ન અને માન્યતા પ્રાપ્ત છે કે નહીં)

૧. પીડીઈયુ, ગાંધીનગર
૨. આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ કોલેજ, કોલકાતા
૩. અન્નાઈ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, તમિલનાડુ
૪. જીજીયુ, સિધ્ધપુર, ગુજરાત
૫. આચાર્ય ઈન્સ્ટિટ્યુટ ઓફ ગ્રેજ્યુએટ સ્ટડીઝ, બેંગલુરુ
૬. ઉકા તારસડિયા યુનિવર્સિટી, વડોદરા
૭. આંધ્ર લોયોલા કોલેજ, વિજયવાડા

સંસ્થાઓના રેન્કિંગ અંગેની માહિતી અહીં ઉપલબ્ધ છે - <https://www.nirfindia.org/2022/Ranking.html>

ડિસ્ટન્સ લર્નિંગ ઈન્સ્ટિટ્યુટ

- ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)
- ડૉ. બી. આર. આંબેડકર ઓપન યુનિવર્સિટી

ઓનલાઈન અભ્યાસક્રમો

- www.skillindiadigital.gov.in
- www.ncs.gov.in
- <https://anubandham.gujarat.gov.in>



મને સ્કેન કરો



વેબસાઈટ પર જુઓ

સાહિત્ય ગાથા

શિવાની દેવ પરિસંવાદ દુભાષિયા અને અનુવાદક છે. તેણીએ લેડી શ્રી રામ કોલેજ (મહિલાઓ માટેની કોલેજ)માંથી વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે, ત્યારબાદ તેમણે ફેન્ય, ફેન્ય ભાષા અને સાહિત્યમાં એમ.ફિલ કર્યું છે, ત્યારબાદ સેન્ટર ફોર ફેન્ય એન્ડ ફેકોફોન, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જે.એન.યુ.)માંથી ફેન્ય ભાષા અને સાહિત્યમાં ડોક્ટર ઓફ ફિલોસોફીનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ સિમોન ડી બેઉવોયર માટે લે ડ્યૂઉકસીએમ સેક્સે (૫ સેકન્ડ સેક્સ, ૧૯૪૯)ના હિન્દી અને અંગ્રેજી અનુવાદમાં વ્યસ્ત છે.*

સ્ત્રોત: <https://jnu.academia.edu/ShivaniDev>

*ઉપરોક્ત માહિતી ફક્ત તાલીમ હેતુઓ માટે છે અને તેનો ઉપયોગ કોઈપણ વ્યાવસાયિક લાભ માટે કરવામાં આવશે નહીં.